

હ્યુસ્ટન મેથડિસ્ટ (Houston Methodist)

નીતિ અને વિધિ F186

વિષય: લંબાવેલી ચૂકવણીનો વિકલ્પ	અમલી તારીખ: જાન્યુઆરી 1, 2016
લાગુ પડે છે: હોસ્પિટલો અને ફિઝિશિયન સંગઠન (PO)	સુધારો/સમીક્ષા કર્યાની તારીખ: જાન્યુઆરી 1, 2016
ઉદભવનો વિસ્તાર: રેવન્યુ સાયકલ કાઉન્સિલ (Revenue Cycle Council)	નિયત સમીક્ષા તારીખ: જાન્યુઆરી 1, 2019

I. નીતિ

જેઓ પોતાનું બેલેન્સ પૂરેપૂરું એક જ હપ્તામાં ચૂકવી ન શકે તેવા દર્દીઓ માટે હ્યુસ્ટન મેથડિસ્ટ (Houston Methodist) વ્યાજમુક્ત લંબાવેલી ચૂકવણીનો વિકલ્પ આપશે.

II. વિધિઓ

A. લંબાવેલી ચૂકવણીનો વિકલ્પ સ્થાપિત કરવામાં નીચેની માર્ગદર્શિકાઓનો ઉપયોગ કરવાનો છે:

1. લંબાવેલી ચૂકવણી માટે લાયક લઘુત્તમ ખાતા બેલેન્સ \$50 છે;
2. પૂરેપૂરું બેલેન્સ ચૂકવવા માટે મહત્તમ લંબાવી શકાતો સમય 18 મહિના છે; અને
3. લઘુત્તમ માસિક ચૂકવણી \$20 થી ઓછી ન હોવી જોઈએ.

B. લંબાવેલી ચૂકવણીની શરતોના ઉલ્લંઘન માટે લેવામાં આવનારા પગલાં નીચે પ્રમાણે છે:

1. મુદતના 50% થી ઓછા સમય માટે કરેલી ચૂકવણી ચૂકી જવાયેલી ચૂકવણી માનવામાં આવે છે;

2. ચૂકી જવાયેલી ચૂકવણીઓ તે ચૂકી જવાયાના ચાર મહિનાની અંદર પૂરી કરવી જોઈએ જેથી ચૂકવણીનો પ્લાન વર્તમાન ગણાઈ શકે; અને
 3. ચૂકી જવાયેલી ચૂકવણીના ચાર મહિનાની અંદર વર્તમાન સ્થિતિમાં ન હોય તેવો લંબાવેલી ચૂકવણીનો કોઈપણ પ્લાન બાકી નીકળતું લેણું માનવામાં આવશે અને તેને ખરાબ ઋણમાં લાવવામાં આવશે.
- c. જ્યારે દર્દીને વધારાનું બેલેન્સ ભોગવવું પડે ત્યારે સ્થાપિત ચૂકવણીના પ્લાન પર નીચેના પગલાં લેવામાં આવશે:
1. માસિક ચૂકવણીના 10% કરતા ઓછું હોય તેવું વધારાનું બેલેન્સ માસિક ચૂકવણીની રકમ વધારીને ચૂકવણીના પ્લાનમાં ઉમેરવામાં આવશે; અને
 2. માસિક ચૂકવણીના 10% કરતા વધારે હોય તેવું વધારાનું બેલેન્સ ચૂકવણીના હપ્તાની સંખ્યા વધારીને ચૂકવણીના પ્લાનમાં ઉમેરવામાં આવશે.

III. સત્તાવાર સંદર્ભ

1. વસૂલીની નીતિ FI85

રેવન્યુ સાયકલ કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવેલ
CFO કાઉન્સિલ દ્વારા માન્ય

મુખ્ય વહીવટી અધિકારી દ્વારા અધિકૃત:

(ફાઈલ પર મૂળ સહી કરી)

એમ. બૂમ (M. Boom)

તારીખ

પ્રમુખ

મુખ્ય કાર્યકારી અધિકારી

હ્યુસ્ટન મેથડિસ્ટ (Houston Methodist)